



भारतीय विमानपत्तन प्राधिकरण AIRPORTS AUTHORITY OF INDIA

S J Realty Partner Jayaben Prakash Sajnani

Date: 14-05-2021

Sub Plot No. 2, Aarohi Club
Road, Ghuma, Ahmedabad.

System Generated Auto Assessment for Height Clearance

1. Airports Authority of India (AAI) in pursuance of responsibility conferred by and as per the provisions of Govt. of India (Ministry of Civil Aviation) order GSR 751 (E) dated 30th Sep. 2015 for Safe and Regular Aircraft Operations has assessed the site data filled by the applicant.

2. Assessment details for Height Clearance:

NOC ID :	AHME/WEST/B/051221/545731
Applicant Name*	Mehul B Chaudhari (Mo. No. 7405448346)
Site Address*	Sur. No. 835, 840, 868, 869, F.P.No. 253, Sub Plot No. 2, T.P.S. No.3 (Ghuma), At. Ghuma, Ta. Daskroi, Ahmedabad.
Site Coordinates*	23 01 40.76N 72 27 25.09E, 23 01 40.12N 72 27 25.26E, 23 01 40.93N 72 27 25.95E, 23 01 40.28N 72 27 26.13E
Site Elevation in mtrs AMSL as submitted by Applicant*	46.88 M
Type Of Structure*	Building

*As provided by applicant

Your site is located at a distance 18023 mts from ARP and lies in the grid N3 of the published CCZM of Ahmedabad airport. The Permitted top elevation for this grid is 155 mts.

Since the requested top elevation 81.88 mts in AMSL is below CCZM permitted top elevation, the NOC for height clearance is not required from Airports Authority of India.

3. This assessment is subject to the terms and conditions as given below:

a. The site-elevation and site coordinates provided by the applicant are taken for calculation of the permissible top elevation for the proposed structure. If however, at any stage it is established that the actual data is different from the one provided by the applicant, this assessment will become invalid.

b. The Site coordinates as provided by the applicant in the NOC application has been plotted on the street view map and satellite map as shown in ANNEXURE. Applicant/Owner to ensure that the plotted coordinates corresponds to his/her site. In case of any discrepancy, this assessment shall be treated as null and void

c. Airport operator or his designated representative may visit the site (with prior coordination with applicant or owner) to ensure that assessment terms & conditions are complied with.

d. The assessment is further subject to the provisions of Section 9-A of the Indian Aircraft Act, 1934 and any notifications issued there under from time to time including the Aircraft (Demolition of Obstruction caused by Buildings and Trees etc.) Rules, 1994.

राजीव गांधी भवन
Rajiv Gandhi Bhawan

साफ़दरजंग हवाई अड्डा नई दिल्ली-110003
Safdarjung Airport, New Delhi-110003

दूरभाष : 24632950
Phone: 24632950



भारतीय विमानपत्तन प्राधिकरण AIRPORTS AUTHORITY OF INDIA

e. The applicant is responsible to obtain all other statutory clearances from the concerned authorities including the approval of building plans. This assessment for height is to ensure the safe and regular aircraft operations and shall not be used as document for any other purpose/claim whatsoever, including ownership of land etc.

f. Use of oil, electric or any other fuel which does not create smoke hazard for flight operations is obligatory, within 8 KM of the Aerodrome Reference Point.

g. This assessment has been issued w.r.t. the Civil Airports as notified in GSR 751(E). Applicant needs to seek separate NOC for Defence, if the site lies within jurisdiction of Defence Airport. Applicants also need to seek clearance from state Govt. as applicable, for sites which lies in the jurisdiction of unlicensed civil aerodrome as outlined in Rule 13 of GSR751 (E).

This assessment is system auto generated and thus does not require any signature

Designated Officer

Region Name: WEST

Address: General Manager (ATM)

Email ID: vaah.noc@aai.aero

Contact No: 079-22858111

राजीव गांधी भवन
Rajiv Gandhi Bhawan

सफदरजंग हवाई अड्डा नई दिल्ली-110003
Safdarjung Airport, New Delhi-110003

दूरभाष : 24632950
Phone: 24632950

AHMEDABAD MUNICIPAL CORPORATION

FIRE & EMERGENCY SERVICE

DANAPITH FIRE STATION, (H. Q.)AHMEDABAD - 380 001

PH. : (079) 22148466 / 67 / 68, 32981178, 32981500 FAX : (079)

No. - OPN150119052021 Dt.:19/05/2021

To,

RESI + COMM,

2,SHREE,AVADHPURI SOCIETY OPP , BINORI BUNGLOWS AAROHI CLUB ROAD , BOPAL NR , JAY

2,SHREE,AVADHPURI SOCIETY OPP , BINORI BUNGLOWS AAROHI CLUB ROAD , BOPAL NR , JAY

Sub: Fire safety & protection, opinion for a proposed high-rise building / Low-Rise Building - High Rise Building

Sir,

This is to intimate that , the plans submitted for, High Rise Building , have all the required line drawings and write-up are as per the requirement of fire prevention and protection.

All norms as per the NBC-2016 part-IV fire and life safety guidelines / Gujarat State Fire Prevention & life safety measures Act - Rules / GDCR (2021) & CBD by AUDA / special instructions given by fire officer in charge or Chief Fire Officer have to be followed as far as the construction and Fire Prevention and Protection system, are to be followed as below.

Staircase :

1.5 meters for 9 to 25 meters building heights.

2.00 meters for 25 meters to above building heights, clear in width.

The staircase and lift shafts shall not go to the basement but if they go they have to be protected by 2 hours fire resistant construction including the doors.

A motorable road with 45 ton load bearing capacity and minimum as mention in table; is required around the building without obstruction to a clear motorable passage for fire/rescue vehicles.

Any transformer to be installed shall be away from the building & leaving open Space required around the building and below building height wise open space required around the building.

Margin for different types of building;

1) 8 to 25 Meters building - 3 meters

Plot area more than 750 sq. mt. : 4 Meters

2) Up to 45 Meters building : 6 Meters

3) Up to 70 Meters building : 8 Meters

The gate (entry) to the premises shall be minimum 6 meters or more if required, in width, entry gate to be provided on both sides.

The Fire Protection system shall be as mentioned in the approved plans.

1. All basements parking and HPP shall be fully sprinklered.

2. All lower basements should have positive pressure ventilation.

3. Electric Cable Shaft should have fire resistant doors.

In this Filed we can write what system they required in building – So whatever here we write that can be mention in final opinion letters

Builder name	RESI + COMM	
Address	2,SHREE,AVADHPURI SOCIETY OPP , BINORI BUNGLOWS AAROHI CLUB ROAD , BOPAL NR , JAY MADI FLAT DASKROI GHUMA , AHMEDABAD - 380058	
T.P.No.	3 (GHUMA)	
F.P.No.	253	
R.S.No.	835+840+868+869	
Sub Plot No.	2	
Surrounding Margin from building		
Common Plot Margin from building		
Building Types	High Rise Building	
	RESI + COMM	
Fire Opinion Remarks	BASEMENT PARKING, HPP & SHOPS SHALL BE FULLY SPRINKLERED. HYDRANT SYSTEM (CONVENTIONAL) ONLY CLASS-C PIPES TO BE USED FIRE PUMP NOT TO BE INSTALLED LOWER THAN 2ND BASEMENT. -FIRE PUMP CAPACITY TO DISCHARGE 900 LITERS PER MINUTE @ 3 BAR PRESSURE MEASURED AT TERRACE LEVEL. -ONE HYDRANT VALVE AND ONE HOSE REEL HOSE WITH ON / OFF SWITCH FOR THE FIRE PUMP (ONE SET PER FLOOR AREA OF 1000 SQ. METERS.) -RISER CUM DOWN COMMER TO BE PROVIDED 100 MM. DIAMETER UP TO 30 METERS, 150 METERS FOR BUILDINGS ABOVE 30 METERS. -ONE UNIT OF CO2 EXTINGUISHER 4.5 KGS AND ONE UNIT OF DCP EXTINGUISHER OF 6 KGS. PER FLOOR (ONE SET PER 1000 SQ. METERS) -FIRE SERVICE INLET TO BE PROVIDED AT THE GROUND LEVEL. •STAND ALONE WITH INBUILT BATTERY TYPE OF SMOKE/ HEAT DETECTORS ARE NOT PERMITTED IN ANY KIND OF OCCUPANCY.	
Block Height From Ground Level to Top Slab(In Meter)	24.75	
	Use	Height(In Meter)
Basement 1	PARKING	3.7500
Hollow Plinth/Ground Floor	SHOP + PARKING	3.2500
Floor 1	RESI	3.0500
Floor 2	RESI	3.0500
Floor 3	RESI	3.0500
Floor 4	RESI	3.0500
Floor 5	RESI	3.0500
Floor 6	RESI	3.0500
Floor 7	RESI	3.0500

Ramp only permitted for 18 to 25 meters building in margin.

Basic Fire Requirement Notes on plan

Take online print of approved opinion and submitted plan copy .The copies of plans are provide during final inspection of the fire fighting system.

After, the building is built and all the required Fire safety and Protection equipment have been installed and after due inspection by the Fire service officer an NOC can be issued.

Note : if plans are submitted for only industrial building approval, Industrial Building -

Information about all processes, raw material and finished material shall be mentioned in plan.

A handwritten signature in blue ink, appearing to read 'Rajesh Bhatt', with a long horizontal stroke extending to the right.

(Rajesh Bhatt)

Chief Fire Officer (I/c)

NS

ବାରିଷ୍ଟ୍ର:-

૨: મરજદારશ્રી પ્રજાદેવભાઈ મંગળાભાઈ પટેલ (ચોરેની તારાબા)
વગરની મરજી.

४. स. प्र. श्री मंसारीजी न। र. नं. ५१४ तारीख १-१-६१ की पुरा
मदद की आवश्यकता.

ମାତ୍ର: ପ୍ରମୁଖ ଶିକ୍ଷାପ୍ରଦାନ କରୁଥିବା ସ୍କୁଲ ନାହିଁ ଏବଂ ଅନ୍ୟ

જી.ન.નં. ઉચ્ચ વંચાણુમં લી છેલ ૧ મ. નં. ૧ વાળા તા: ૨૧-૨-૮૬ ના કુઝમી રહેણુંકના કામે જી.ન.મેલીની પરવાનગી માપવામાં આવેલ પ્લોટ નં. ૮૩૫, ૮૪૦ ની ૨૧૦૪૪ ચોમી જમીનમાં ઉચ્ચ વંચાણુમં લી છેલ ૧ મ. નં. ૧ વાળા તા: ૧૨-૨-૮૦ના કુઝમી રહેણુંકના કામે જી.ન.મેલીની પરવાનગી માપવામાં આવેલ,

મરજદારે વારીખ વગરની મરજ કરી જ્વોર્ન: ૮૧૮, ૮૩૫
૮૪૦ ની રપાઈર થોમી જમીનના રહેણાંક હેતુ માટેના રીવા.
ખાનો નાયબ નગર નિયોજકશ્રી અમદાવાદની ડાયેરી મેળી
મંતુર કરવા બહામ્મુ કરાવી મહે રજુ કરેલ છે. જે મહે વારીખ:
૧૬-૩-૮૧ ના રોજ મહેલ છે.

નાયબ નગર મયોરશ્રી આદાવાદે તેઓના ઉક્ત સંજ્ઞા
માં લીધેલ ૧૪.૧.૩ તારીખના તા:૭-૩-૮૧ના પત્રથી જાણવા.
નકસાઓ મંજૂર કરવા બલામજૂ કરેલ છે.

મરજકારે રજુ કરેલ પ્લાનો સ. ઇ. શ્રી મસલાલી વરદ
તા: ૨૧-૩-૬૧ની સ્થળ વપાસ તથા ચકાસણી મથકે મોકલી
માટેલ.

ક. ઇ. શ્રી મસલાલી જે લેખોના ર. નં. ૫૨૪ તા: ૧-૧-૨૧૫
જારી કાઢાશે કરી રીતના. પ્લાન તેરી હાથ કરી મલકાવ
કે પુરવ કરેલ છે.

કાગળો વધા સ. ઇ. ની ન. ની પ્રાપ્ત
સ્થળ પર પાંચકામ કરેલ નથી. - ENGINEER SHRI RAMLAL
મુ. મંડુરીનાં પ્રકાશની ચરણનં. ૮ મુંજી - PRAFUL SHIRMA
કરેલ ન હોઈ તેમજ સમય મર્યાદામાં - LICENSE NO. 200/M
H. S. RAMLAL SOCIETY, E.
B. M. RAMLAL YARD
R. M. RAMLAL, 10/11/1977

ENGINEER SHRI BALI
PRATAP SINGH
LEARNER NO. 10001
H. K. SINGH SOCIETY
B.M. MARKET YARD
B.M. MARKET YARD

ન હોઈ સરવર્ણગ થયેલ છે. મરજદારે સ. ઇ. ૧૯૧૧ વા: ૨૨-૨-૮૬ ના રોજ માપેલ જવાબમાં સરવર્ણગ કબુલ રાખેલ છે. અને સરવર્ણગ ખદલ નિયમ મુજબ દંડ ભરવા સંમતિ દર્શાવેલ છે. અને રીવા.

ખાનો મંજુર કરવા અને જ્વોકનં. ૮૧૮ ની મુદત જ્વોકનં. ૮૩૫ ૮૪૦ ની સાથે કરી દેવા જવાબ માપેલ છે. સ. ઇ. શ્રી મસલાલી જે સરવર્ણગ ખદલ ઉપર દંડના પગલા લઈ રીવા. ખાનો મંજુર કરવા તથા ૮૧૮ ની મુદત જ્વોકનં. ૮૩૫, ૮૪૦ ની સાથે કરી જ્વોકનં. ૮૧૮ ની મુદત તથા રીવા માંપવા બલામ્બુ કરેલ છે.

ઉક્ત સંઘર્ષી વિગત જોતાં કબજેદારે મુજ મંજુરીના વા: ૨૧-૨-૮૬ તથા વા: ૧૨-૨-૮૦ના હુકમની સરવર્ણ. ૮ મુજબ છ માસમાં બંધકામ કરી કરેલ ન હોઈ સરવર્ણગ થયેલ છે. સરવર્ણગ ખદલ કબજેદારને નોટીસ આપી સફળતાપાત્ર નિર્ણય લેવાનો માય. પરંતુ કબજેદારે સરવર્ણગ કબુલ રાખેલ હોઈ નોટીસ માંપ વાનો પ્રશ્ન રહેલો નથી. સ. ઇ. શ્રી મસલાલી જે માલમાય માપેલ છે. તેમજ નાયબ નગર નિયોજક શ્રી મમદાલાદે રીવા. નકસામો મંજુર કરવા બલામ્બુ કરેલ હોઈ જ. મ. કામદારની કલમ: ૩૭ મુજબ અને મળેલ સત્તાની રહે નીચે મુજબ હુકમ કરું છું.

હુ ક મ:

મુજ મંજુરીના વા: ૨૧-૨-૮૬ તથા વા: ૧૨-૨-૮૦ ના હુકમની સરવર્ણ. ૮ મુજબ સરવર્ણગ થયેલ હોઈ સરવર્ણગ ખદલ રા. રપરડા - મંકે રૂપિયા બે હજાર પાંચસો વીસ પુરા દંડ લેવાનું ઠરાવી મુજ મંજુરીના હુકમોની સરવર્ણને માંધન રહીને ના સામે સામેલ કરેલ રહેલું કેલુ માટેના જ્વોકનં. ૮૧૮, ૮૩૫ અને ૮૪૦નાં રપરૂટર ચોંખી જમીનના રીવા. ખાનો નીચેની તથા રાની સરવર્ણ જે મંજુર કરવાનો હુકમ કરવામાં આવે છે.

૧: દંડની રકમ તલાટીશ્રી કુમારે લેને: ૧૦ માં મંજુરપાઈ કરવાની રહેશે.

૨: હુકમની બારીખમી માં માસમાં બંધકામ કરવાનું

નકલ રવાના:-

૧: મજદુરના ઇન્સપેક્ટર મંગદાસ પટેલ (વકીલ) ના પાસે રીડ, જોધપુર મમદાલાદે વરુ નીચેનાં.



ENGINEER, RAJPUTANA
PUBLIC WORKS
LICENCE NO. 1000/37
H. J. RAMJI & SONS
10, MARUTI YARD
KALKAJI, RAIPUR

41



-3-

- ૨: તલાટી કમ મેટ્રીશી કુમા તા. દસકોઈ વરહ ડાયુના
કાગળો સાથે દેહની રકમની મા. ન. ન. ય મા નીપ કરી
માગણની કાયવાહી કરવા સારી.
- ૩: રેવન્યુ દફતર લાગુ પંચાયત દસકોઈ વરહ દેહની રકમની
તા. ન. ન. ય મા નીપ કરી તલાટીશી કુમા વરહ મોકલવા
સારી.

Signature
ENGINEER
PRAFUL A. SHRIMALI
 LICENCE NO ENG/317
 H. JEMAND SOCIETY,
 BHL MARKET YARD,
 P. B. C. ROAD, KALOL-389724

પરિશિષ્ટ - ૧

મહેસૂલ વિભાગના તા. ના પરિપત્ર ક્રમાંક : નું બિડાણ

પ્રતિ,

જીલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદ

વિષય : જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(અ) હેઠળ બિનખેતી હેતુકેર માટેની અરજી

- (૧) અરજદારનું નામ: S J Realty partnership firm
અરજદારનું સરનામું: B-11, Shree Krishna Centre, Navrangpura
Ahmedabad - 380009
મોબાઈલ નંબર: xxxxxxx075
ઈ-મેઇલ એડ્રેસ: dxxxxxxxxxxxxxxxxxxxxx@yahoo.com

(૨) જમીન અંગેની વિગત,

ગામનું નામ: ધુમા

તાલુકાનું નામ: દશકોઈ

જીલ્લાનું નામ: અમદાવાદ

ટી. પી. સ્કીમ નંબર: 3 ghuma

ફાઇનલ પ્લોટ નંબર: 253 paiki 2

સીટી સરવે નંબર: ---

સરવે નંબર	જુનો સરવે નંબર	૭/૧૨ મુજબ ક્ષેત્રફળ (ચો.મી.)	અરજીનું ક્ષેત્રફળ (ચો.મી.)	સત્તા પ્રકાર (૭/૧૨ મુજબ)
835p	---	550.00	550.00	જુની શરત (જુ.શ)

- (૩) સક્ષમ ઓથોરિટી દ્વારા હાલના બાંધકામનો પ્લાન મંજૂર કર્યાની વિગતો,
હુકમ નંબર: --- હુકમ તારીખ: ---
- (૪) સક્ષમ અધિકારીશ્રીના અગાઉની બિનખેતી પરવાનગીની વિગતો,
હુકમ નંબર: TP/JMN/G/1/REVA.SR/8 હુકમ તારીખ: 11/06/1991
પરવાનગી હેઠળનું ક્ષેત્રફળ [550.00 ચો.મી.]
પરવાનગી હેઠળનો હેતુ [રહેણાંક]
- (૫) હેતુકેર માટેની વિગતો,
માંગણીનો હેતુ [બહુહેતુક ઉપયોગ] તથા માંગણીવાળી જમીન કયા ઝોનમાં સમાવિષ્ટ છે ? [રહેણાંક]
- (૬) બિનખેતી હુકમની તમામ શરતોનું પૂર્ણ/અંશતઃ પાલન થયેલ છે ? [હા]

જમીન મહેસૂલ કાયદા ની કલમ-૬૫/ક હેઠળ તથા પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર હેતુકેરના સંદર્ભમાં થતી રૂપાંતરવેરા- અન્ય વેરાની તફાવતની રકમની સાથેસાથ મુળ હેતુ માટે મળેલ પરવાનગીના હુકમની શરતોના ભંગ બદલ દંડનીય રકમ પણ ભરવા અને મુળ હુકમની અને હાલના હેતુકેરના હુકમની પ્રવર્તમાન કાયદા-નિયમો તથા નિયત તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવા સંમતિ સહ બાંહેધરી આપીએ છીએ તથા જો કાયદા/નિયમ વિરુદ્ધનું બાંધકામ હશે તો તે સ્વખર્ચે દૂર કરવા સંમતિ સહ બાંહેધરી આપું છું.

સ્થળ : Ahmedabad

તારીખ : 13/01/2022

કબજેદાર/ કબજેદારોના નામ અને સહી (૭/૧૨ મુજબ)

1. એસ. જી. રીયલ્ટી એ નામની ભાગીદારી પેઢી ના ભાગીદારો

2. સંગીતા મનિષભાઈ કોઠારી અને **S J Realty**

S. Manish
Partner

3. જયા પ્રકાશ સજનાની

S J Realty
Jaya P. Sagarnani
Partner

સુચના: ૭/૧૨ મુજબના તમામ કબજેદાર/ કબજેદારો/ ખાતેદારોની સહીથી જ અરજી કરવી. જો એક કરતા વધુ સરવે નંબર હોય તો સરવે નંબર વાર અલગ અરજી કરવી.

કબજેદાર/ કબજેદારોના નામ અને સહી (૭/૧૨ મુજબ)

4. - સબ પ્લોટ નંબર-૨ ની ૫૫૦ ચો.મી.

સુચના: ૭/૧૨ મુજબના તમામ કબજેદાર/ કબજેદારો/ ખાતેદારોની સહીથી જ અરજી કરવી. જો એક કરતા વધુ સરવે નંબર હોય તો સરવે નંબર વાર અલગ અરજી કરવી.

Application No. 30706202200371 Confirmation No. 58919210

Page 2 of 2

i-ORA (Integrated Online Revenue Applications)

Revenue Department, Government of Gujarat

E- Receipt (Applicant's Copy)**Application Fee Online Payment Detail**

Application Number :	30706202200371
Merchant Order No :	932529645891921007
Name of Applicant :	S J Realty partnership firm
Bank Reference No :	202201792521205
SBI ePay Reference ID :	1247702234528
CIN :	10005682022011702612
Transaction Amount :	275.00
Transaction Date :	2022-01-17 15:51:40
Status :	SUCCESS

Note: This statement is electronically generated, does not required any signature.

u3)A
17/1/22

THE KALUPUR COMMERCIAL CO-OP BANK LTD

PANCHWATI BRANCH

60/905/AUTH/AN/60/2006

ભારત 67201

SPLADH. ગુજરાત

148416

JAN 17 2022

ZERO ZERO ZERO ZERO ZERO TIME ZERO

14:14

Rs.0000050

PB5612

INDIA

STAMP DUTY GUJARAT



SERIAL No. A43 2022

D.B. SEJWANI
NOTARY
GOVT. OF INDIA
17 JAN 2022

પરિશિષ્ટ - ૨

મહેસૂલ વિભાગના તા. ના પરિપત્ર ક્રમાંક : નું બિડાણ

સોગંદનામું

(રૂ.૫૦/-ના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પર)

આથી હું/અમે, આ સોગંદનામા પર સહી કરનાર....

અ.નં.	કબજેદારનું નામ	સરનામું	ઉંમર
1	એસ. જે. રીયલ્ટી એ નામની ભાગીદારી પેઢી ના ભાગીદારો	B-11, Shree Krishna Centre, Navrangpura Ahmedabad - 380009	49
2	સંગીતા મનિષભાઈ કોઠારી અને	B-11, Shree Krishna Centre, Navrangpura Ahmedabad - 380009	49
3	જયા પ્રકાશ સજનાની	B-11, Shree Krishna Centre, Navrangpura Ahmedabad - 380009	48
4	- સબ પ્લોટ નંબર-૨ ની ૫૫૦ ચો.મી.	Ghuma	48

આથી હું/અમે મારા/અમારા ધર્મના સોગંદ પર પ્રતિજ્ઞાપૂર્વક નીચેની વિગતો કે જે અમે આ જમીનની હક્કપત્રક નોંધો અને તમામ ૭/૧૨ ને તપાસી કે જે સત્ય છે તે રજૂ કરીએ છીએ.

સરવે નંબર 835p, જુનો સરવે નંબર ---, મોજે ધુમા, તાલુકો દશકોઈ, જિલ્લો અમદાવાદ, ક્ષેત્રફળ 550 ચો.મી. વાળી જમીન જીલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદ ના હુકમ ક્રમાંક: TP/JMN/G/1/REVA.SR/8 તા. 11/06/1991 થી રહેણાંક હેતુ સબબ બિનખેતીની પરવાનગી મળેલ છે.

- (૧) બિનખેતી વિષયક જે હેતુ માટે પરવાનગી મળેલ છે તે મુજબ ઉપયોગ થાય છે ? હા
- (૨) બિનખેતી હુકમની નિયત શરત મુજબ મંજૂર થયેલ પ્લાન પ્રમાણે બાંધકામ ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરેલ છે ? હા
- (૩) બાંધકામ થયેલ છે? હા
કુલ ક્ષેત્રફળ 550 ચો.મી.
સાર્વજનિક/રસ્તાનું ક્ષેત્રફળ ચો.મી.
બાંધકામનું ક્ષેત્રફળ 341.57 ચો.મી.
- (૪) બિનખેતી પરવાનગીવાળી જમીન કે અમુક હિસ્સો/પ્લોટના વેચાણ થયેલ છે ? ના
- (૫) ઉક્ત ક્રમ-૧ થી ૪ ની વિગત સિવાય બિનખેતી પરવાનગી હુકમની અન્ય તમામ શરતોનું પાલન થયેલ છે ? હા
- (૬) મહેસૂલી અધિકારીશ્રી (મામલતદારશ્રી/ પ્રાંત અધિકારીશ્રી/ કલેક્ટરશ્રી) સમક્ષ કોઈ કેસ કાર્યવાહી પડતર છે ? ના
- (૭) નામ. તાલુકા-જિલ્લા અદાલત/ ગુ. વ. અદાલત/ સર્વોચ્ચ અદાલત દિલ્હી/ ગુ. મ. પંચ/ સચિવશ્રી (વિવાદ) ની કોર્ટમાં કોઈ કેસ કાર્યવાહી પડતર છે ? ના
- (૮) આ જમીન પરત્વે કોઈ મહેસૂલી અધિકારી કે નામદાર અદાલત તરફથી યથાવત સ્થિતિ જાળવી રાખવા, કામચલાઉ કે કેસના આખરી નિર્ણય સુધી મનાઈ ફરમાવવા હુકમ થયેલ છે ? ના
- (૯) આ જમીન પરના બાકી લેણાં સંદર્ભે જપ્તી અંગેની કોઈ કાર્યવાહી ચાલુ છે ? ના
- (૧૦) સદર જમીન પર અન્ય કોઈ સંસ્થા/ મંડળી/ કંપની/ સરકારનો બોજો છે ? ના
- (૧૧) જો આ જમીન પર કોઈ બેંક/ મંડળીનો બોજો બાકી હોય તો, તે ભરપાઈ કર્યા સિવાય આ મિલકત કોઈપણ પ્રકારે વેચાણ, ભેટ, વસિયત, બાનાખત, ગિરો કરીશ/ કરીશું નહિ અને કોઈપણ અન્યને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માલિકી કે કબજો ભોગવતો તબદીલ કરીશ/ કરીશું નહિ.



- (૧૨) આ જમીન અન્ય કોઈ હેતુ માટે સંપાદન સારૂ કાર્યવાહી ચાલુ છે ? ના
- (૧૩) આ જમીન સંબંધે આ અગાઉ બિનખેતી હેતુ ફેરની મંજૂરી માટે અરજી કરી હતી ? ના
- (૧૪) આ ઉપરાંત વિશેષમાં હું/ અમે આથી જાહેર કરીએ છીએ કે,

- a) આ જમીન પર સરકારશ્રીનું કોઈ હિત સમાયેલ નથી.
- b) આ જમીનનો સમાવેશ રહેણાંક ઝોનમાં થાય છે અને જે અન્વયે રહેણાંક હેતુ માટે બિનખેતી વિષયક બાંધકામ/ ઉપયોગ સારૂ પરવાનગી મળેલ છે. હેતુફેર માટેની બહુહેતુક ઉપયોગ હેતુ માટેની માંગણી છે.
- c) સદર જમીનની ચતુર્દિશા
પૂર્વે : Nalia Road
પશ્ચિમ : Society Road
ઉત્તરે : Sub Plot 1
દક્ષિણે : Sub Plot 3
- d) બિનખેતીના હેતુફેર ની માંગણીવાળી આ જમીન ટાઉન પ્લાનિંગ સ્કિમ અન્વયે કપાતમાં નથી.
- e) સરદ જમીન, GDCRની જોગવાઈ મુજબ, નોન ડેવલપ્ડ એરિયા, સબ મર્જડ એરિયા અથવા રિઝર્વેશનમાં સમાવિષ્ટ નથી.

f) માંગણી હેઠળની જમીનનું સમગ્ર ક્ષેત્રફળ મહદઅંશે આવરી લેવાય તે રીતે જમીનની હાલની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ/ ફોટોગ્રાફ્સ નીચે લગાવેલ છે



(અરજદારે ઉપર લગાવેલ ફોટોગ્રાફ પર (માંકર પેનથી) સહી કરી તારીખ લખવી.)

- (૧૫) જમીનમાં હેતુફેરની મંજૂરી મળ્યા બાદ ભવિષ્યમાં ટી.પી.સ્કીમ આખરી થતા ક્ષેત્રફળની વધ થાય તો તે ક્ષેત્રફળ ઉપર નિર્ણયની તારીખ રોજની નીતિ પ્રમાણે નિયમોનુસાર પ્રિમિયમની રકમ ભરપાઈ કરવા બાંહેધરી આપીએ છીએ અને ક્ષેત્રફળ ઘટે તો ભરેલ પ્રિમિયમની રકમ રીફંડ મેળવવા માટે કોઈ હકક દાવો કરીશું નહિ કે અન્ય કોઈ પણ કોર્ટમાં દાવો કરીશું નહિ.
- (૧૬) જમીન મહેસૂલ કાયદા ની કલમ-૬૭(એ) અન્વયેની જોગવાઈ, સરકારશ્રીના વખતોવખતના અને અદ્યતન ઠરાવો / પરિપત્રો / સૂચનાઓ થકી નિર્ધારિત કાર્યરીતિ તથા રૂપાંતર વેરાના દરો આધિન નિર્દિષ્ટ દરો મુજબ રૂપાંતર વેરો / તફાવત વેરો તથા શરતભંગ અંગે દંડની રકમ જે ઠરાવવામાં આવે તે રકમ ભરપાઈ કરવા બાંહેધરી આપીએ છીએ.
- (૧૭) અમોએ માંગણી કરેલ જમીનનો ઉપયોગ જે હેતુ માટે માંગણી કરી છે તે હેતુ અમારી માંગણીવાળી જમીનમાં જી.ડી.સી.આર. મુજબ મળવાપાત્ર છે તેની અમોને જાણ છે તથા તે અનુસારની જ અમોએ માંગણી કરી છે તે અમોને બંધનકર્તા રહેશે.
- (૧૮) જો ઉપર જણાવેલ હકીકતો પૈકીની કોઈપણ હકીકત ખોટી માલુમ પડશે તો અમોને આપવામાં આવતી જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૬૭ અન્વયેની મંજૂરી / સદર જમીનના પ્લાન/નકશાની મંજૂરી રદ ગણાશે તથા રદ કરવામાં આવશે તો અમોને બંધનકર્તા રહેશે અને તે બાદ ઉપસ્થિત થનાર તમામ કાયદાકીય તથા નાણાંકીય જવાબદારી મારી/અમારી રહેશે.
- (૧૯) ઉક્ત કામે સક્ષમ અધિકારી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે અમોને બંધનકર્તા રહેશે.
- (૨૦) અમો એ બાબતે પણ બાંહેધરી આપીએ છીએ કે ઉપર જણાવ્યા મુજબની કોઈપણ વિગતે ખોટી અથવા અર્ધસત્ય કે ગેરમાર્ગે દોરનાર કે છેતરપીંડી વાળી હોય તો આથી આપવામાં આવેલી બિનખેતીની મંજૂરીને પરિણામે ઉભી થનારી સઘળી પરિસ્થિતિ અંગેની સઘળી જવાબદારી અમારી રહેશે અને રાજ્ય સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં. તેમજ આ પ્રકારની ખોટી માહિતી રજૂ કરવા બદલ પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ અમારી સામે કાયદેસર/ કાનુની કાર્યવાહી થઈ શકશે તે હું/ અમે સ્વીકારીએ છીએ.
- (૨૧) સરકારશ્રી દ્વારા પ્રવર્તમાન જોગવાઈઓ તથા શરતો મુજબ જે પ્રિમિયમની રકમ / દંડ / વધારાના તફાવતની રકમ નક્કી કરવામાં આવશે તે અમો / હું ભરવા સંમતિ આપીએ છીએ તથા ભરપાઈ કર્યા બાદ પરત માગીશું નહિ.

ઉપરોક્ત સોગંદનામું વાંચી-સમજીને, સઘળી હકીકત ખરી અને સત્ય જાહેર કરીને આજે, તા. 13/01/2022 ના રોજ મારી/ અમારી હયાતીમાં તથા સંપૂર્ણ સલામ અવસ્થામાં, બિનકેફ હાલતમાં, કોઈપણ જાતના દાબદબાણ વિના, મુક્ત સંમતિથી મારા/ અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરેલ છે.

અમોએ અમારા કબજા ભોગવટાની સ્વતંત્ર / સંયુક્ત માલિકીની ઉક્ત મોજે ધુમા, તાલુકો દશકોઈ, જીલ્લો અમદાવાદ ની કુલ ક્ષેત્રફળ 550 ચો.મી. પૈકી ક્ષેત્રફળ 341.569 ચો.મી. વાળી જમીનમાં તા. 18/05/2005 થી બહુહેતુક ઉપયોગ હેતુ માટે વગર પરવાનગીએ ખેતીની જમીનનો બિનખેતી હેતુનો ઉપયોગ / વપરાશ શરૂ કરેલ છે. જે અંગે સરકારશ્રી દ્વારા જે કોઈ દંડની રકમ, વિશેષધારો, શિક્ષણ ઉપકર, લોકલ ફંડ તથા અન્ય ભરવાપાત્ર જે કોઈ રકમ નકકી કરવામાં આવે તે ભરવા સહમતી આપીએ છીએ.

ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો બને છે તે હું જાણું છું/ અમે જાણીએ છીએ. તેમજ ખોટું સોગંદનામું કરવા બદલ ખોટી વિગતો રજૂ કરીને જાણી બુઝીને સરકારી અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા બદલ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૯૮ અન્વયે અમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે તેવું જાહેર કરીએ છીએ.

સ્થળ : અમદાવાદ

કબજેદાર/ કબજેદારોની સહી

તારીખ : 13/01/2022

ફોટો 1

1. એસ. જે. રીયલ્ટી એ નામની ભાગીદારી પેઢી ના ભાગીદારો

2. સંગીતા મનિષભાઈ કોથારી અને

S. J. Realty
Partner

3. જયા પ્રકાશ સજનાની

S. J. Realty
Jaya P. Sajani
Partner

4. - સબ પ્લોટ નંબર-૨ ની ૫૫૦ ચો.મી.

ફોટો 4

સાક્ષીની સહી :

(૧) નામ :

Prakash Sajani

Prakash Lalchand

પુરું સરનામું :

L 14 Orchid Whitefield Makarba Ahmedabad

(૨) નામ :

Manishbhai Kothari

પુરું સરનામું :

18 Sarthi bungalows Sola Ahmedabad

ઓળખ આપનારનું નામ અને સહી

Raju Sejwani

પુરું સરનામું :

303 National Plaza Navrangpura Ahmedabad




રૂબરૂ
(નોટરી/મેજિસ્ટ્રેટ)

SOLEMNLY AFFIRMED
BEFORE ME

D. B. SEJWANI
NOTARY
GOVT OF INDIA

17 JAN 2022





ભારતીય વિશિષ્ટ ઓળખાણ માધ્યમ

ભારત સરકાર
Unique Identification Authority of India
Government of India

નોંધણીની ઓળખ / Enrollment No.: 2141/43464/58787

To
કોઠારી સંગીતા મનીષ
Kothari Sangita Manish
18 Sarthi Bungalows
Near Florence Residency Science City Road, Sola
Sola
Daskroi Ahmedabad
Gujarat 380060
9825190051

04/05/2017
37869829

MD378698296FH



તમારો આધાર નંબર / Your Aadhaar No. :

9307 1668 7529

મારો આધાર, મારી ઓળખ



ભારત સરકાર


Government of India

કોઠારી સંગીતા મનીષ

Kothari Sangita Manish

જન્મ તારીખ / DOB : 08/01/1973


સ્ત્રી / Female



9307 1668 7529

મારો આધાર, મારી ઓળખ

S. Manish



નિર્દેશ

- આધાર ઓળખનું પ્રમાણ છે, નાગરિકતાનું નહિ .
- ઓળખનું પ્રમાણ ઓનલાઇન ઓથેન્ટિકેશન દ્વારા પ્રાપ્ત કરો .

INFORMATION

- Aadhaar is proof of identity, not of citizenship .
- To establish identity, authenticate online .



- આધાર દેશભરમાં માન્ય છે .
- આધાર ભવિષ્યમાં સરકારી અને બિન-સરકારી સેવાઓનો લાભ મેળવવામાં ઉપયોગી થશે .
- Aadhaar is valid throughout the country .
- Aadhaar will be helpful in availing Government and Non-Government services in future .



ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ
Unique Identification Authority of India

સરનામું:
18, સારથી બંગ્લોઝ, ફ્લોરેન્સ
રેસિડેન્સી ની પાસે, સાયન્સ સિટી રોડ,
સોલા, સોલા, અમદાવાદ, સોલા,
ગુજરાત, 380060

Address:
18, Sarthi Bungalows, Near
Florence Residency, Science City
Road, Sola, Sola, Ahmedabad,
Sola, Gujarat, 380060

9307 1668 7529



1947



help@uidai.gov.in



www.uidai.gov.in

S.M. Kothari

आयकर विभाग
INCOME TAX DEPARTMENT

भारत सरकार
GOVT. OF INDIA

SANGITA KOTHARI
M H MEHTA
08/01/1973
Permanent Account Number
ALZPK9260E



WANI
D (CUJ.)
F INDIA
J. 4013/07
ES DATE
6 - 2023

GOVT OF INDIA

S m. Kothari



आयकर विभाग
INCOME TAX DEPARTMENT

भारत सरकार
GOVT. OF INDIA

स्थायी लेखा संख्या कार्ड
Permanent Account Number Card

ARTPS8240G

नाम / Name
JAYA PRAKASH SAJNANI

पिता का नाम / Father's Name
LAXMANDAS BHAGCHAND THADANI

जन्म की तारीख / Date of Birth
30/11/1974

हस्ताक्षर / Signature
Jaya P. Sajani

05058038

Jaya P. Sajani



भारत सरकार
GOVERNMENT OF INDIA



साजनाणी जया

Sajnani Jaya

DOB: 30-11-1974

Gender: Female



6601 4671 8240

आधार - आम आदमी का अधिकार

Jaya P. Sajnani



भारतीय विशिष्ट पहचान प्राधिकरण
UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA

W/O प्रकाश, अल-14, ओरचिड
वाइट फील्ड, मकरबा रेलवे क्रॉसिंग
पासे, वोडाफोन हाउस सामे, मकरबा,
प्राह्लादनगर एक्सटन., अहमदाबाद
शहर, वेजलपुर, अहमदाबाद सिटी,
अहमदाबाद, गुजरात, 380051

Address:

W/o Prakash, L-14, Orchid White
Field, Near Makarba Railway
Crossing, Opposite Vodafone
House, Makarba, Prahladnagar
Extn., Ahmadabad City, Vejalpur,
Ahmadabad City, Ahmedabad,
Gujarat, 380051



1947
1800 300 1947



help@uidai.gov.in

www

www.uidai.gov.in

P.O. Box No. 1947,
Bengaluru-560 001

Jaya P. Sajnani



आयकर विभाग
INCOME TAX DEPARTMENT

भारत सरकार
GOVT. OF INDIA

PRAKASH LALCHAND SAJNANI
LALCHAND KIMATRAI SAJNANI

06/05/1971
Permanent Account Number
AHHP55622G

Prakash Lalchand
Signature

16022008

Prakash Lalchand

Boleslaw Lechowski

आयकर विभाग
INCOME TAX DEPARTMENT
MANISH S KOTHARI



भारत सरकार
GOVT. OF INDIA

SURYAKANTBHAI PANACHAND
KOTHARI
28/04/1969
Permanent Account Number
AEJPK8025J



Manish
Signature



Manish



ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ

ભારત સરકાર

Unique Identification Authority of India
Government of India

નોંધણીની ઓળખ / Enrollment No.: 2141/43464/58788

To,
કોઠારી મનીષ સૂર્યકાંત
Kothari Manish Suryakant
18
Sarathi Bunglows
Near Florence Residency Science City Road, Sola
Sola
Sola Daskroi Ahmedabad
Gujarat 380060
9328033999

Ref: 839 / 17Q / 168978 / 169028 / P



SB293631458FH



તમારો આધાર નંબર / Your Aadhaar Number

9029 1618 1898

મારો આધાર, મારી ઓળખ



ભારત સરકાર

Government of India



કોઠારી મનીષ સૂર્યકાંત
Kothari Manish Suryakant
જન્મ તારીખ / DOB : 28/04/1969
પુરુષ / Male



9029 1618 1898

મારો આધાર, મારી ઓળખ

Manish



निर्देश


- આધાર ઓળખનું પ્રમાણ છે, નાગરિકતાનું નહિ .
- ઓળખનું પ્રમાણ ઓનલાઇન ઓથેન્ટિકેશન દ્વારા પ્રાપ્ત કરો .

INFORMATION

- Aadhaar is proof of identity, not of citizenship .
- To establish identity, authenticate online .

17Q / 168978

- આધાર દેશભરમાં માન્ય છે .
- આધાર ભવિષ્યમાં સરકારી અને બિન-સરકારી સેવાઓનો લાભ મેળવવામાં ઉપયોગી થશે .
- Aadhaar is valid throughout the country .
- Aadhaar will be helpful in availing Government and Non-Government services in future .



ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ
Unique Identification Authority of India

સરનામું: 18, સારથી બંગ્લોઝ, ફ્લોરેન્સ રેસિડેન્સી ની પાસે, સાયન્સ સિટી રોડ, સોલા, સોલા, અમદાવાદ, સોલા, ગુજરાત, 380060

Address: 18, Sarthi Bungalows, Near Florence Residency, Science City Road, Sola, Sola, Ahmedabad, Sola, Gujarat, 380060

9029 1618 1898



1947



help@uidai.gov.in

www

www.uidai.gov.in

W882

INDIA NON JUDICIAL
Government of Gujarat
Certificate of Stamp Duty





सत्यमेव जयते

₹300

₹300 ₹300

Certificate No. : IN-GJ91624482705100U
Certificate Issued Date : 18-Jan-2022 01:15 PM
Account Reference : IMPACC (AC)/ gj13125711/ GULBAI TEKRA/ GJ-AH
Unique Doc. Reference : SUBIN-GJGJ1312571116641167203549U
Purchased by : JAYA P SAJNANI
Description of Document : Article 14 Bond
Description : AFFIDAVIT CUM DECLARATION FOR RERA
Consideration Price (Rs.) : 0
(Zero)
First Party : SANGITA M KOTHARI AND ANOTHER
Second Party : Not Applicable
Stamp Duty Paid By : SANGITA M KOTHARI AND ANOTHER
Stamp Duty Amount(Rs.) : 300
(Three Hundred only)



IN-GJ91624482705100U

KC 0019455073


Statutory Alert:

1. The authenticity of this Stamp certificate should be verified at 'www.stcilestamp.com' or using e-Stamp Mobile App of Stock Holding. Any discrepancy in the details on this Certificate and as available on the website / Mobile App renders it invalid.
2. The onus of checking the legitimacy is on the users of the certificate.
3. In case of any discrepancy please inform the Competent Authority.

SERIAL No. Alu 2022

138

D.B. SEJWANI
NOTARY
GOVT. OF INDIA
18 JAN 2022



Affidavit cum Declaration

Affidavit cum Declaration of Mrs. Sangita M Kothari and Mrs. Jaya P Sajnani duly authorized by the promoter of Shrey Elysium (S J Realty).

I, Ms. Sangita M Kothari and Ms. Jaya P Sajnani, duly authorized by the promoter of Shrey Elysium (S J Realty) undertake and state as under that;

1. We have applied for registration of our project Shrey Elysium on 10/11/2021 to The Gujarat Real Estate Regulatory Authority, Gandhinagar. In response we received Ack. No. PR/AHMEDABAD/DASKROI/GUJRERA/211123/011965 on 23/11/2021 and subsequently we received list of queries including query for revised NA.
2. In this regard, we have made application for revised NA on 17/01/2022 and the copy of the application and payment receipt is attached.
3. We, declare that we are bind to provide to The Gujarat Real Estate Regulatory Authority, Gandhinagar a copy of revised NA Order as soon as we receive the same.



S.M.K.

S.M. Kothari
(SANGITA MANISH KOTHARI)



Jaya P. Sajnani

Jaya P. Sajnani
(JAYA PRAKASH SAJNANI)

**SOLEMNLY AFFIRMED
BEFORE ME**


138

D.B. SEJWANI
NOTARY
GOVT OF INDIA
18 JAN 2022

Witness:- Rakesh Lalchand
(R RAKASH, L. SAJNANI)

Manish Kothari
(MANISH KOTHARI)





ભારતીય વિશેષ ઓળખાણ પ્રાધિકરણ

ભારત સરકાર


Unique Identification Authority of India

Government of India

નોંધણીની ઓળખ / Enrollment No.: 2141/43464/58787

To
કોઠારી સંગીતા મનીષ
Kothari Sangita Manish
18 Sarthi Bungalows
Near Florence Residency Science City Road, Sola
Sola
Daskroi Ahmedabad
Gujarat 380060
9825190051

04/05/2017
37869829



MD378698296FH



તમારો આધાર નંબર / Your Aadhaar No. :

9307 1668 7529

મારો આધાર, મારી ઓળખ



ભારત સરકાર

Government of India

કોઠારી સંગીતા મનીષ
Kothari Sangita Manish
જન્મ તારીખ / DOB : 08/01/1973
સ્ત્રી / Female




9307 1668 7529



મારો આધાર, મારી ઓળખ

S.M.Kothari



भारत सरकार
GOVERNMENT OF INDIA




साजनाणी जया

Sajnani Jaya

DOB: 30-11-1974

Gender: Female



6601 4671 8240

आधार - आम आदमी का अधिकार

Jaya P. Sajnani




भारतीय विशिष्ट पहचान प्राधिकरण
UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA

W/O प्रकाश, अल-14, ओरचिड
वाइट फ़िल्ड, मकरबा रेलवे क्रॉसिंग
पास, वोडाफोन हाउस सामे, मकरबा,
प्राह्लादनगर एक्सटन., अहमदाबाद
शहर, वेजलपुर, अहमदाबाद सिटी,
अहमदाबाद, गुजरात, 380051

Address:

W/o Prakash, L-14, Orchid White
Field, Near Makarba Railway
Crossing, Opposite Vodafone
House, Makarba, Prahladnagar
Extn., Ahmadabad City, Vejalpur,
Ahmadabad City, Ahmedabad,
Gujarat, 380051



1947
1800 300 1947




help@uidai.gov.in



www.uidai.gov.in

P.O. Box No. 1947,
Bengaluru-560 001

Jaya P. Sajnani



भारत सरकार
GOVERNMENT OF INDIA

साजनाणी प्रकाश
Sajnani Prakash
DOB: 06-05-1971
Gender: Male

7041 2767 0167

आधार - आम आदमी का अधिकार

Prakash Lalchand

भारतीय विशिष्ट पहचान प्राधिकरण
UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA

Address:
S/o Lalchand, L-14, Orchid White
Field, Near Makarba Railway
Crossing, Opposite Vodafone
House, Makarba, Prahladnagar
Extn., Ahmadabad City, Vejalpur,
Ahmadabad City, Ahmedabad,
Gujarat, 380051

1947
1800 300 1947

help@uidai.gov.in www.uidai.gov.in

P.O. Box No. 1947,
Bengaluru-560 001

Prakash Lalchand



ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ


ભારત સરકાર

Unique Identification Authority of India
Government of India

નોંધણીની ઓળખ / Enrollment No.: 2141/43464/58788

To,
કોઠારી મનીષ સુર્યકાંત
Kothari Manish Suryakant
18
Sarathi Bunglows
Near Florence Residency Science City Road, Sola
Sola
Sola Daskroi Ahmedabad
Gujarat 380060
9328033999

Ref: 839 / 17Q / 168978 / 169028 / P



SB293631458FH



તમારો આધાર નંબર / Your Aadhaar No. :

9029 1618 1898

મારો આધાર, મારી ઓળખ



ભારત સરકાર

Government of India



કોઠારી મનીષ સુર્યકાંત
Kothari Manish Suryakant
જન્મ તારીખ / DOB : 28/04/1969
પુરુષ / Male



9029 1618 1898

મારો આધાર, મારી ઓળખ

